

ITI Asset Management Limited

Investment Manager for ITI Mutual Fund

Registered Office: ITI House, 36,  
Dr. R. K. Shirodkar Marg, Parel,  
Mumbai - 400 012, Maharashtra

Toll Free No: 1800 266 9603

E : [mfassist@itiorg.com](mailto:mfassist@itiorg.com)

W : [www.itiadc.com](http://www.itiadc.com)

CIN: U67100MH2008PLC177677

ITI

MUTUAL FUND

Long-term wealth creators

NOTICE CUM ADDENDUM No. 47/2025

Hosting of Annual Report and Abridged Annual Report of the Scheme(s) of ITI Mutual Fund for the financial year ended March 31, 2025

NOTICE is hereby given to the Unit Holders of the Scheme(s) of ITI Mutual Fund ("the Fund") that, in accordance with the provisions of Regulation 56(1) of SEBI (Mutual Funds) Regulations, 1996 read with SEBI Master Circular No. SEBI/HO/IMD/IMD-PoD-1/P/ CIR/2024/90 dated June 27, 2024, the Annual Report of the Schemes of ITI Mutual Fund and an abridged summary thereof for the Financial Year ended March 31, 2025 has been hosted on the website of the Fund [www.itiadc.com](http://www.itiadc.com) and on AMFI's website [www.amfindia.com](http://www.amfindia.com) respectively.

Investors may accordingly view / download the reports from the website of the Fund.

A link of the Annual Report/Abridged Annual Report shall be sent via email to the Investors whose e-mail ids are registered with the Fund.

Further, Unit holders may also request for a physical or electronic copy of the Annual Report or abridged summary thereof by writing to us at the email address [mfassist@itiorg.com](mailto:mfassist@itiorg.com) or calling on the toll free number 1800-266-9603 or submitting a written request at any of the official points of acceptance of the Fund. Such copies shall be provided to the unit holders free of cost.

Further, Unit holders are encouraged to register their email id with us for periodic updates on emails.

For ITI Asset Management Limited  
(Investment Manager for ITI Mutual Fund)

Sd/-

Authorised Signatory

Place: Mumbai

Date : 30/07/2025

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

Hero

FINCORP

HERO FINCORP LIMITED

Registered office: 34, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi - 110057

Corporate office: 9, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi - 110057

Fax: 011-49487197, Tel. No: 011-49487150, Website: [www.herofincorp.com](http://www.herofincorp.com)

CIN: U74899DL1991PLC046774

Statement of Unaudited Standalone Financial Results for the quarter ended June 30, 2025

₹ in Crore

S. No	Particulars	Quarter ended		Year ended
		June 30, 2025	June 30, 2024	March 31, 2025
		(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total Income From Operations	2,334.59	2,261.68	9,152.85
2	Net Profit/ (loss) for the period (before tax and exceptional items)	(23.73)	88.82	198.37
3	Net Profit/ (loss) for the period before tax (after exceptional items)	(23.73)	88.82	198.37
4	Net Profit/ (loss) for the period after tax (after exceptional items)	(49.72)	39.52	57.84
5	Total Comprehensive income/ (loss) for the period [Comprising profit/ (loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	(79.77)	25.52	32.29
6	Paid up Equity Share Capital	129.27	127.31	127.41
7	Reserves (excluding revaluation reserve)	5,802.39	5,685.41	5,584.99
8	Securities Premium Account	4,194.23	3,940.45	3,949.61
9	Net worth	5,931.66	5,812.72	5,712.40
10	Paid up Debt Capital/Outstanding Debt	46,194.69	42,302.53	47,226.03
11	Outstanding Redeemable Preference Shares	-	-	-
12	Debt Equity Ratio	7.79	7.28	8.27
13	Earnings Per Share (of ₹ 10 each)			
	i). Basic :*	(3.89)	3.10	4.54
	ii). Diluted :*	(3.89)	3.10	4.53
14	Capital Redemption Reserve	-	-	-
15	Debenture Redemption Reserve	-	-	-
16	Debt Service Coverage Ratio	N.A.	N.A.	N.A.
17	Interest Service Coverage Ratio	N.A.	N.A.	N.A.

\*not annualised for the quarter ended

Notes:

a) The financial results for the quarter ended June 30, 2025 have been reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors at its meeting held on July 29, 2025. These financial results for the quarter ended June 30, 2025 have been subjected to limited review by joint statutory auditors in compliance with Regulation 52 of the Securities Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended.

b) The above is an extract of detailed format of quarterly financial results filed with the Stock Exchange under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the quarterly standalone financial results are available on the websites of National Stock Exchange of India (NSE) at [www.nseindia.com](http://www.nseindia.com) and the Company at [www.herofincorp.com](http://www.herofincorp.com).

c) For the items referred in sub-clauses of the Regulation 52 (4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 the pertinent disclosures have been made to the National Stock Exchange of India (NSE) and can be accessed on the website of National Stock Exchange of India (NSE) at [www.nseindia.com](http://www.nseindia.com) and the Company at [www.herofincorp.com](http://www.herofincorp.com).

For and on behalf of the Board

Sd/-

Abhimanyu Munjal

Managing Director & CEO

Place: Gurugram

Date: July 29, 2025

ACGL

AUTOMOBILE CORPORATION OF GOA LIMITED

CIN: L35911GA1980PLC000400

Regd. Office: Honda, Sattari, Goa - 403 530.

Tel: 0832-2383003; Email: [sectl@acglgoa.com](mailto:sectl@acglgoa.com); Website: [www.acglgoa.com](http://www.acglgoa.com)

EXTRACT OF STATEMENT OF AUDITED RESULTS FOR THE QUARTER ENDED 30 JUNE 2025

(₹ in Lakhs)

Sr. No.	Particulars	3 months ended 30 June 2025 (Audited)	Preceding 3 months ended 31 March 2025 (Refer note 2)	Corresponding 3 months ended 30 June 2024 (Audited)	Previous year ended 31 March 2025 (Audited)
1.	Total income from operations	25,641.27	21,686.33	20,332.42	66,076.74
2.	Profit before tax	3,090.07	2,258.59	2,419.25	6,250.14
3.	Profit after tax	2,307.31	1,683.60	1,791.67	4,660.42
4.	Total Comprehensive Income [Comprising Profit (after tax) and Other Comprehensive Income (after tax)]	2,248.97	1,652.07	1,835.05	4,697.29
5.	Equity Share Capital	608.86	608.86	608.86	608.86
6.	Reserves (excluding revaluation reserve) as shown in the audited Balance sheet				24,765.25
7.	Basic and diluted Earnings per share (in ₹) * (not annualised)	37.90*	27.65*	29.43*	76.54

Notes

1. These results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 30 July 2025. The statutory auditors have expressed an unmodified audit opinion on these results.

2. The figures for the quarter ended 31 March 2025 represent the difference between the audited figures in respect of the full financial year ended 31 March 2025 and the published figures for the nine month ended 31 December 2024.

3. A final dividend of Rs. 20 per equity share of Rs. 10 each was approved by the shareholders at the Annual General Meeting held on 02 July 2025 for the year ended 31 March 2025. The dividend was paid on 28 July 2025.

For Automobile Corporation of Goa Limited

Pranab Ghosh

CEO & Executive Director

DIN 10536772

Place : Honda, Goa

Dated: 30 July 2025

Note: Results are also available on the website of the company - [www.acglgoa.com](http://www.acglgoa.com) and BSE Limited - [www.bseindia.com](http://www.bseindia.com). The same can be accessed by scanning the QR code provided below.

Bharat Rasayan Limited

Regd. Office: 1501, Vikram Tower, Rajendra Place, New Delhi - 110008

CIN: L24119DL1989PLC036264

Email: [investors.br@bharatgroup.co.in](mailto:investors.br@bharatgroup.co.in) Website: [www.bharatgroup.co.in](http://www.bharatgroup.co.in)

NOTICE

is hereby given, pursuant to Regulations 29 & 47 read with Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (Listing Regulations), that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Tuesday, August 12, 2025, inter-alia, to consider and approve the standalone & consolidated un-audited financial results of the Company for the first quarter and three months ended June 30, 2025.

The said Notice may be accessed on the Company's website at <https://www.bharatgroup.co.in> and may also be accessed on the Listed Stock Exchange website at <https://www.nseindia.com>.

Further, the Trading Window of the Company shall remain closed from July 30, 2025 to August 14, 2025 (both days inclusive) for the specified persons in terms of Code of Conduct of the Company to regulate, monitor and report of trading in Company's securities by insiders framed under the SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015.

For BHARAT RASAYAN LIMITED

Sd/-

(NIKITA CHADHA)

Company Secretary

New Delhi

July 30, 2025

MARUTI SUZUKI

MARUTI SUZUKI INDIA LIMITED

CIN: L34103DL1981PLC011375

Regd. Off.: Plot No.1, Nelson Mandela Road, Vasant Kunj, New Delhi-110070

Ph.: +91 (11) 46781000, Fax: +91 (11) 46150275

[www.marutisuzuki.com](http://www.marutisuzuki.com), [investor@maruti.co.in](mailto:investor@maruti.co.in)

NOTICE

(SPECIAL WINDOW FOR RE-LODGEEMENT OF TRANSFER REQUESTS OF PHYSICAL SHARES OF MARUTI SUZUKI INDIA LIMITED)

Pursuant to SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/PIR/2025/97 dated 2<sup>nd</sup> July 2025, Shareholders of Maruti Suzuki India Limited (the "Company") are hereby informed that a Special Window is opened for a period of six months, from 7<sup>th</sup> July 2025 to 6<sup>th</sup> January 2026 to facilitate re-lodgement of transfer request of physical shares of the Company.

This facility is available for Transfer Deed(s) lodged prior to 1<sup>st</sup> April 2019 and which were rejected/returned/not attended to due to deficiency in the documents/process or otherwise. Shareholders of the Company who have missed the earlier deadline of 31<sup>st</sup> March 2021, are encouraged to take advantage of this opportunity by furnishing the necessary documents to the Company's Registrar and Transfer Agent i.e. KFin Technologies Limited at Selenium Building, Tower - B, Plot No. 31 & 32, Financial District, Nanakrampada, Serilingampally, Rangareddy, Hyderabad - 500032, Telangana, India.

For Maruti Suzuki India Limited

Sanjeev Grover

Executive Officer & Company Secretary

New Delhi

30<sup>th</sup> July 2025

quant

quant Mutual Fund

Registered Office: 6<sup>th</sup> Floor, Sea Breeze Building, A. M. Road, Prabhadevi, Mumbai - 400 025.

Tel.: +91 22 6295 5000 E-mail: [help.investor@quant.in](mailto:help.investor@quant.in) Website: [www.quantmutual.com](http://www.quantmutual.com)

NOTICE NO. 16/2025

Hosting of Annual Report and Abridged Annual Report of the Schemes of quant Mutual Fund

NOTICE is hereby given that in accordance with Regulation 54 and 56 of Securities & Exchange Board of India (Mutual Funds) Regulations, 1996 read with SEBI Master Circular no. SEBI/HO/IMD/IMD-PoD-1/P/CIR/2024/90 dated June 27, 2024, the Scheme Annual Report and Abridged Annual Report ("the Annual Reports") of quant Mutual Fund for the period ended 31<sup>st</sup> March, 2025 have been hosted on the website of quant Mutual Fund viz. [www.amfiindia.com](http://www.amfiindia.com) and on the website of Association of Mutual Funds in India viz. [www.amfiindia.com](http://www.amfiindia.com). Investors can access / download the Annual Reports from the above-mentioned websites.

Unitholders can submit a request for a physical or electronic copy of the Scheme Annual Report or Abridged summary thereof by any of the following modes at free of cost:

1. Email: [help.investor@quant.in](mailto:help.investor@quant.in);

2. Call on: 022-6295 5000;

3. Letter: Write a request letter at the Registered Office of the AMC or any of the Investor Service Centres of KFin Technologies Limited, list available at <https://quantmutual.com/about-us/contact-us>

For quant Money Managers Limited

Sd/-

Authorised Signatory

Place : Mumbai

Date : July 31, 2025

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS, READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

zydus wellness

nourish · nurture · energize

Zydus Wellness Limited

Registered office : Zydus Corporate Park, Scheme No. 63, Survey No. 536 Khoraj (Gandhinagar), Nr. Vaishodevi Circle, Sarkhej-Gandhinagar Highway, Ahmedabad 382 481.

Tel. No. (+91-79) 4804 0000, Website: [www.zyduswellness.com](http://www.zyduswellness.com), CIN: L15201G11994PLC023490

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2025

The Board of Directors of Zydus Wellness Limited ("the Company") at their meeting held on Wednesday, July 30, 2025 has approved unaudited financial results (standalone and consolidated) for the quarter ended June 30, 2025 ("results") along with the Auditor's Reports thereon.

The results along with the Auditor's Reports are available on the website of the Company: <https://zyduswellness.com/investor/SEintimationOutcomeofBM-25-26-q1.pdf>, BSE Limited: [www.bseindia.com](http://www.bseindia.com) and National Stock Exchange of India Limited: [www.nseindia.com](http://www.nseindia.com) and can also be accessed by scanning the following Quick Response Code:

By Order of the Board,  
For Zydus Wellness Limited,

Dr. Sharvil P. Patel

Chairman

DIN: 00131995

Date: July 30, 2025

Place: Ahmedabad

PSP

Build to Last

PSP Projects Limited

CIN :L45201GJ2008PLC054868

Registered Office : PSP House, Opp. Celesta Courtyard,  
Opp. Lane of Vikram Nagar Colony, Iscon-Ambli Road, Ahmedabad - 380 058

Website : [www.pspprojects.com](http://www.pspprojects.com)

UN-AUDITED FINANCIAL RESULTS (STANDALONE & CONSOLIDATED) FOR THE QUARTER ENDED JUNE 30, 2025

The Board of Directors of the Company, at their Meeting held on July 30, 2025 approved the Un-Audited Financial Results (Standalone & Consolidated) for the quarter ended June 30, 2025.

The results, along with the Limited Review Report, have been posted on the Company's website at <https://www.pspprojects.com/financial-performance/> and can be accessed by scanning the QR code.

Note: The above intimation is in accordance with Regulation 33 read with Regulation 47(1) of the SEBI (Listing Obligation & Disclosure Requirements) Regulations, 2015.

For and behalf of Board of Directors  
of PSP Projects Limited

Sd/-

Prahaladbhai S. Patel

Chairman, Managing Director & CEO, DIN: 00037633

Place : Ahmedabad

Date : July 30, 2025

THE INDIAN WOOD PRODUCTS COMPANY LIMITED

CIN: L20101WB1919PLC003557

Regd Office: 9, Brabourne Road, Kolkata – 700 001

Email id: [iwpho@iwpkatha.co.in](mailto:iwpho@iwpkatha.co.in), Website: [www.iwpkatha.com](http://www.iwpkatha.com), Phone: 033-40012813, Fax: 033 - 22426799

STATEMENT OF UNAUDITED STANDALONE & CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2025

(Rs. in Lakhs)

Particulars	STANDALONE				CONSOLIDATED			
	Quarter Ended		Year Ended		Quarter Ended		Year Ended	
	30.06.2025	31.03.2025	30.06.2024	31.03.2025	30.06.2025	31.03.2025	30.06.2024	31.03.2025
	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited
Total Income From Operation	5,149.14	5,479.23	5,640.73	22,635.94	5,149.14	5,479.23	5,640.73	22,635.94
Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	103.87	138.22	128.86	506.41	140.41	156.76	149.90	667.77
Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	103.87	138.22	128.86	506.41	140.41	156.76	149.90	667.77
Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	78.39	66.11	104.73	367.79	114.93	84.65	125.77	529.15
Total Comprehensive Income for the period [(Comprising Profit) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	74.30	103.41	87.10	352.19	110.84	106.17	108.14	497.77
Equity Share Capital (Face Value Rs. 2/- each)	1,279.75	1,279.75	1,279.75	1,279.75	1,279.75	1,279.75	1,279.75	1,279.75
Reserves excluding Revaluation reserve	-	-	-	34,591.90	-	-	-	34,679.57
Earnings per share(Basis & Diluted) (Face value Rs. 2/- per share)	0.12	0.10	0.16	0.57	0.18	0.13	0.20	0.83

1) The above is an extract of the detailed format of Quarterly Result filled with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Results are available on the stock exchange's website i.e. [www.bseindia.com](http://www.bseindia.com) and also at the website of the Company i.e. [www.iwkatha.com](http://www.iwkatha.com).

By Order of the Board  
For The Indian Wood Products Co Ltd

Bharat Mohta

Whole Time Director & CEO

(DIN 00392090)

Place : Kolkata

Date : 30.07.2025

epaper.financialexpress.com


Ahmedabad



<div>SCHEDULE I</div> <div>FORM A</div> <div>PUBLIC ANNOUNCEMENT</div>	
<div>(Regulation 14 of the Insolvency and Bankruptcy Board of India (Voluntary Liquidation Process) Regulations, 2017)</div> <div>FOR THE ATTENTION OF THE STAKEHOLDERS OF</div> <div>HCK CAPITAL SERVICES PRIVATE LIMITED</div>	
1. Name of the Corporate Person	HCK Capital Services Private Limited
2. Date of Incorporation of Corporate Person	06.01.2010
3. Authority Under Which Corporate Person Is Incorporated / Registered	Registrar of Companies, Chennai
4. Corporate Identity Number of Corporate Person	U65921TN2010PTC074172
5. Address of the registered office and Principal Office (if any) of Corporate Person	Kothari Buildings, No. 117, Mahatma Gandhi Road, Nungambakkam, Chennai - 600034.
6. Liquidation Commencement date of Corporate Person	30.07.2025
7. Name Address  Email address Telephone number and Registration number of the Liquidator	T V Suresh Kumar Temple Tower, 7th Floor, H-5, No.672, Anna Salai, Nandanam, Chennai - 600 035. suresh@tsklegal.com 9566011211 2919/12314
8. Last date for submission of claims	20.08.2025
Notice is hereby given that <b>HCK Capital Services Private Limited</b> has commenced Voluntary Liquidation on <b>30.07.2025</b> .	
The stakeholders of <b>HCK Capital Services Private Limited</b> are hereby called upon to submit a proof of their claims, on or before 29.08.2025 to the Liquidator at the address mentioned against Item 7.	
The Financial Creditors shall submit their proof of claims by electronic means only. All other stakeholders may submit the proof of claims in person, by post or by electronic means.	
Submission of false or misleading proof of claims shall attract penalties.	
Date: 31.07.2025 Place: Chennai	Name : T V Suresh Kumar Voluntary Liquidator

કબજ નોટિસ (સ્થાવર મિલકત માટે)	
<b>જે અંતર્ગત,</b>	
નીચે સહી કરનાર, કે જે સિક્યુરિટાઈઝેશન એન્ડ રિસ્ક્લ્કશન બોર્ડ ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ફ્રેસ્ટ એક્ટ 2002 હેઠળ સમ્માન કેપિટલ લિમિટેડ ના (CIN:L65922DL2005PLC136029) (અગાઉ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતું હતું) અધિકૃત અધિકારી છે અને કલમ 13(12) ના વાંચન સાથે સિક્યુરીટી ઇન્ફ્રેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ 2002 ના નિયમ ૩ હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરતાં 21.12.2023 ના રોજ ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવી છે. જેમાં ખરીદદારો રમેશ કે વસાણી ઉર્ફે રમેશ કનુભાઈ વસાણી (પ્રોપાઇટર એન્ડ ચાર. કે. લેસ) અને દસાબેન રમેશભાઈ વસાણી ને નોટિસમાં જણાવેલી લોન ખાતું નં. HLAPSUR00417333 સામે કથિત સૂચના પ્રાપ્ત થયાની તારીખથી 60 દિવસની અંદર હકીકતમાં સુકવણી થાય ત્યાં સુધી 19.12.2023 થી વ્યાજ દરે રૂ. 12,11,930.70 (રૂપિયા બાર લાખ અગિયાર હજાર નવસો ત્રીસ અને સિતેર પૈસા માત્ર) ની સૂચનામાં ઉલ્લેખ કરાયેલી રકમની ભાવિ વ્યાજે સુકવણીની તારીખ સુધી પુનઃ સુકવણી કરવા માટે આ સાથે જાણ કરવામાં આવેલ છે.	
કર્ડદાર આ રકમ સુકવવામાં નિષ્ફળ જવાથી સામાન્ય જનતાને આ દ્વારા સૂચના આપવામાં આવે છે કે, નીચે સહી કર્તા દ્વારા સિક્યુરીટી ઇન્ફ્રેસ્ટ (એન્ફોર્સમેન્ટ) - રૂલ્સ - 2002 સૂચિત કાયદો નિયમ 8 સાથે વાંચતા તેની કલમ 13 ની પેટા - કલમ (4) હેઠળ તેને આપાયેલી સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે વર્ણન કરાયેલી મિલકતના કબ્જે તારીખ 26.07.2025. ના રોજ લેવામાં આવ્યો છે.	
ખાસ કરીને કર્જદાર અને જાહેર જનતાને અત્રે ચેતવવામાં આવે છે કે કથિત મિલકતના સોદામાં પડવું નહીં અને જો તે મિલકતને લગતા કોઈ પણ સોદા કરવામાં આવશે તો રૂ. 12,11,930.70 (રૂપિયા બાર લાખ અગિયાર હજાર નવસો ત્રીસ અને સિતેર પૈસા માત્ર) 19.12.2023 ની તારીખથી અને તેના ઉપર ચકત વ્યાજ સમ્માન કેપિટલ લિમિટેડ (અગાઉ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતું હતું) ના હકને આધીન રહેશે.	
સુરક્ષીત અરુદ્યામતોને પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયના સંબંધમાં અધિનિયમની કલમ 13 ની પેટા કલમ (8) ની જોગવાઈ મુજબ ઉધાર લેનાર નું ધ્યાન દોરવામાં (આમંત્રિત) કરવામાં આવે છે.	
<b>સ્થાવર મિલકતનું વર્ણન</b>	
વાસ્તવિક મુજબ 'બી' બિલ્ડિંગમાં ભોય તળીયુ મિલકત દુકાન નં. 12 ના તે બધા દુકકા અને પાર્સલ, અને બિલ્ડીંગ 'બી' માં ભોંય તળીયુ પાર્સિંગ પ્લાન મુજબ દુકાન નં. 7, સુડા મુજબ બાંધકામ સાથે અને રેરા કાપેટ વિસ્તાર માપન 21.18 સ્ક્વેર મીટરસં અને સુડા મુજબ બિલ્ટ-અપ વિસ્તાર માપન 22.96 સ્ક્વેર મીટરસં 'ઓમ પેલેસ' તરીકે ઓળખાતી બિલ્ડીંગની ચોરવામાં, લેન્ડ બેરિંગ રેવન્યુ સર્વે નંબર 4૩ પર બાંધવામાં આવ્યું, જમીન પાઈડ્રીની બ્લોક નંબર 46 માપન ૩-૩3-72 સ્ક્વેર મીટરસં તરીકે નોંધાયેલ, અને આપેલ ટી.પી. નંબર 45 (નવાગામ-વાવ) અને મોજે ગામ નવાગામ તાલુકા કામરેજવા એફ.પી. નં 28 ની મિલકત રહેઠાણ માટે 1૩876.48 સ્ક્વેર મીટરસં અને વાણિજ્યિક હેતુ માટે ૩86.52 સ્ક્વેર મીટરસં કુલ 14263 સ્ક્વેર મીટરસં, જિલ્લો સુરત - 395006, ગુજરાત. કથિત મિલકત નીચે મુજબ બંધાયેલ છે.	
પૂર્વ : દુકાન નં. 13 ની મિલકત ઉત્તર : બિલ્ડીંગ 'બી'નું પાર્કિંગ	પશ્ચિમ : દુકાન નંબર 11 ની મિલકત દક્ષિણ : મુખ્ય માર્ગ
સહી/- તારીખ : 26.07.2025 સ્થળ : સુરત	અધિકૃત અધિકારી સમ્માન કેપિટલ લિમિટેડ (અગાઉ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતું હતું)

<p><b>એસેટ્સ કેઅર એન્ડ રિસ્ક્લ્કશન એન્ટરપ્રાઇઝ લિમિટેડ (“એસીઆરઈ”)</b> CIN : U65993DL2002PLC115769</p> <p><b>રજિ. ઓફિસ:</b> 14મો માળ, ઘરોરા કોર્પોરેટ ટાવર, નેહરૂ પ્લેસ, નવી દિલ્હી-110019 ઇ-મેલ: acre.arc@acreindia.in વેબસાઈટ: www.acreindia.in <b>કોર્પોરેટ ઓફિસ:</b> સુનિટ નંબર 502, સી બિંગ, વન નીકેસી, પ્લોટ નંબર સી - 66, ગુ - બ્લોક, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, મુંબઈ - 400051. ટેલિફોન : 022 68643101</p>	<p><b>કબજ નોટિસ</b> (સ્થાવર મિલકત માટે)</p> <p>જે અંતર્ગત,</p> <p>કે જે સિક્યુરિટાઈઝેશન એન્ડ રિસ્ક્લ્કશન બોર્ડ ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ફ્રેસ્ટ એક્ટ 2002 હેઠળ સમ્માન કેપિટલ લિમિટેડ (અગાઉ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતું હતું) ના અધિકૃત અધિકારી છે અને કલમ 13(12) ના વાંચન સાથે સિક્યુરીટી ઇન્ફ્રેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ 2002 ના નિયમ ૩ હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરતાં 23.11.2021 ના રોજ ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવી છે. જેમાં ખરીદદારો રેતાબેન અને ભડેરી અને ભડેરી સારંગ્ય આર ને નોટિસમાં જણાવેલી લોન ખાતું નં. S0640XXIII (અગાઉ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ (આઇએચએસએલ) લોન ખાતું નં. HLAPARA00210614) સામે કથિત સૂચના પ્રાપ્ત થયાની તારીખથી 60 દિવસની અંદર હકીકતમાં સુકવણી થાય ત્યાં સુધી 20.11.2021 થી વ્યાજ દરે રૂ.32,66,985.31 (રૂપિયા બગીસ લાખ છાસહ હજાર નવસો પંચાસી અને એકત્રીસ પૈસે માત્ર) ની સૂચનામાં ઉલ્લેખ કરાયેલી રકમની ભાવિ વ્યાજે સુકવણીની તારીખ સુધી પુનઃ સુકવણી કરવા માટે આ સાથે જાણ કરવામાં આવેલ છે. વધુમાં આઇએચએસએલ, એ ઇન્ડિયાબુલ્સ એસેટ રિસ્ક્લ્કશન કંપની લિમિટેડની તરફેણમાં તેના તમામ અધિકારો, રીપેક્ટ અને વ્યાજ ઇન્ડિયાબુલ્સ એસાસરી-XXIII, દરૂ ના દરૂદી તરીકે તારીખ 31.12.2021 ના અસાઇનમેન્ટ કરાર દ્વારા સોંપવામાં આવ્યા છે, વધુમાં ઇન્ડિયાબુલ્સ એસેટ રિસ્ક્લ્કશન કંપની લિમિટેડ, ઇન્ડિયાબુલ્સ એસાસરી-XXIII, દરૂના દરૂદી તરીકે તારીખ 29.06.2022 ના અસાઇનમેન્ટ કરાર દ્વારા એસેટ્સ કેઅર એન્ડ રિસ્ક્લ્કશન એન્ટરપ્રાઇઝ લિમિટેડ (“એસીઆરઈ”) ની તરફેણમાં તેના તમામ અધિકારો, રીપેક્ટ અને ઉપરોક્ત લોન ખાતુંનું વ્યાજ સોંપું છે અને લોન ખાતું જેને એસીઆરઈ ની બુક્કસમાં લોન ખાતું નં. S0640XXIII તરીકે કરીચ નંબર આપ્યો છે.</p> <p>કર્ડદાર આ રકમ સુકવવામાં નિષ્ફળ જવાથી સામાન્ય જનતાને આ દ્વારા સૂચના આપવામાં આવે છે કે, નીચે સહી કર્તા દ્વારા સિક્યુરીટી ઇન્ફ્રેસ્ટ (એન્ફોર્સમેન્ટ) - રૂલ્સ - 2002 સૂચિત કાયદો નિયમ 8 સાથે વાંચતા તેની કલમ 13 ની પેટા - કલમ (4) હેઠળ તેને આપાયેલી સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે વર્ણન કરાયેલી મિલકતના કબ્જે તારીખ 27.07.2025 ના રોજ લેવામાં આવ્યો છે.</p> <p>ખાસ કરીને કર્જદાર અને જાહેર જનતાને અત્રે ચેતવવામાં આવે છે કે કથિત મિલકતના સોદામાં પડવું નહીં અને જો તે મિલકતને લગતા કોઈ પણ સોદા કરવામાં આવશે તો રૂ.32,66,985.31 (રૂપિયા બગીસ લાખ છાસહ હજાર નવસો પંચાસી અને એકત્રીસ પૈસે માત્ર) 20.11.2021 ની તારીખથી અને તેના ઉપર ચકત વ્યાજ સમ્માન કેપિટલ લિમિટેડ (અગાઉ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતું હતું) ના હકને આધીન રહેશે.</p> <p>સુરક્ષીત અરુદ્યામતોને પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયના સંબંધમાં અધિનિયમની કલમ 13 ની પેટા કલમ (8) ની જોગવાઈ મુજબ ઉધાર લેનાર નું ધ્યાન દોરવામાં (આમંત્રિત) કરવામાં આવે છે.</p>
<b>સ્થાવર મિલકતનું વર્ણન</b>	
સર્વે નં. 259/પી, દેવપરા, દેવપરા શાક માર્કેટ નજીક , નીલકંઠ સિનેમા નજીક, રાજકોટ, ગુજરાત - 360002.	
સહી/- અધિકૃત અધિકારી	
તારીખ : 27.07.2025 સ્થળ : સુરત	એસેટ્સ કેઅર એન્ડ રિસ્ક્લ્કશન એન્ટરપ્રાઇઝ લિમિટેડ (102 દરૂદે)
કોઈપણ ફરિયાદ માટે તમે શ્રી મોહમ્મદ શારીફ મલિક, ફરિયાદ નિવારણ અધિકારી, ફોન નંબર 011-66115609, ઇમેલ: complaint@acreindia.in. પર સંપર્ક કરી શકો છો. સંસ્થામાં ફરિયાદ નિવારણ મિકેનિઝમ પરની વિગતવાર નોંધિય છે <a href="http://www.acreindia.in/compliance">www.acreindia.in/compliance</a> . પર ઍક્સેસ કરી શકાય છે.	

<div> <b>KOGTA FINANCIAL (INDIA) LIMITED</b></div> <div>Regd. Office: 'Kogta House' Azad Mahalla, Near Railway Station, Bijnagar, Rajasthan-305624 * Website: <a href="http://www.kogta.in">www.kogta.in</a> * Email: <a href="mailto:compliance@kogta.in">compliance@kogta.in</a> Phone: 0141-6767000 * CIN: U67120RJ1996PLC011406</div>				
Statement of Unaudited Financial Results for the quarter ended on June 30, 2025				
Regulation 52 (B), read with Regulation 52 (4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2019 (LODR Regulations) (Amount in Lacs, except EPS)				
Sl. No.	Particulars	Quarter Ended 30.06.2025 Unaudited	Quarter Ended 30.06.2024 Unaudited	Year Ended 31.03.2025 Audited
1	Total Income from Operations	28730.68	20762.37	100156.36
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	4852.20	3194.54	22316.46
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	4852.20	3194.54	22316.46
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	3640.54	2370.24	16619.22
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	3647.69	2362.91	16614.76
6	Paid up Equity Share Capital	5396.20	5345.29	5391.75
7	Reserves (excluding Revaluation Reserve)	196350.67	177795.54	192562.82
8	Securities Premium Account	137487.28	137488.26	137449.31
9	Net worth	208632.23	190244.26	205162.90
10	Paid up Debt Capital / Outstanding Debt	50789.21	380533.09	476923.78
11	Outstanding Redeemable Preference Shares	NIL	NIL	NIL
12	Debt Equity Ratio	2.42	1.99	2.32
13	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -			
1	Basic:	6.75	4.44	30.99
2	Diluted:	2.00	1.46	9.39
14	Capital Redemption Reserve	Not Applicable	Not Applicable	Not Applicable
15	Debitum Redemption Reserve	Not Applicable	Not Applicable	Not Applicable
16	Debit Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable
17	Interest Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable

**Note:** (1) The above is an extract of the detailed format of quarterly and annual results filed with the Stock Exchanges under Regulation 52 of the LODR Regulations. The full format of the quarterly/annual financial results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (<https://www.bseindia.com> and <https://www.kogta.in/investor-information/financial-performance/>). (2) For the other line items referred in regulation 52 (4) of the LODR Regulations, pertinent disclosures have been made to the Stock Exchange(s) (BSE Ltd.) and can be accessed on the URL (<https://www.bseindia.com>). (3) The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.

For and on behalf of Board of Directors of  
**KOGTA FINANCIAL (INDIA) LIMITED**  
Sd/-  
Arun Kogta (Managing Director & CEO)  
DIN: 05109722

સંબંધિત વિગતો	
1	કોર્પોરેટ દેવાદરજી નામ
2	કોર્પોરેટ દેવાદરજા ઇન્ફોર્મેશનની તારીખ
3	અધિકારી જે હેઠળ કોર્પોરેટ દેવાદાર નોંધાયેલ/ ઇન્ફોર્મેટ હોય છે
4	કોર્પોરેટ દેવાદરજા કોર્પોરેટ ઓળખ નં
5	કોર્પોરેટ દેવાદરજા રજિસ્ટર્ડ ઓફિસ અને મુખ્ય ઓફિસ (જો કોઈ હોય તો) નું સરનામું
6	કોર્પોરેટ દેવાદરજાની નાદારીના આરંભની તારીખ
7	નાદારી રેગ્યુલેશન પ્રક્રિયાની સમાપ્તિની અંતિમિત તારીખ
8	અંતિમિ રેગ્યુલેશન વ્યવસાયીક તરીકે કામ કરના ઇન્ફોર્મેટની વ્યવસાયીકનું નામ અને રજીસ્ટ્રેશન નંબર
9	અંતિમિ રેગ્યુલેશન વ્યવસાયીકનું નોંડકાર નંબર
10	અંતિમિ રેગ્યુલેશન વ્યવસાયીક સાથે કરનારા પબ્લિકહાર મારેનું સરનામું અને ઇ-મેઇલ
11	દાવાના સળમિશન માટેની છેલ્લી તારીખ
12	અંતિમિ રેગ્યુલેશન વ્યવસાયીક દ્વારા જણાવેલ કેશલન રવના સમ-કેશલન (6A) ના કલોગ-(B) હેઠળના લેહદારો જો કોઈ હોય તો તેમની શ્રેણી
13	લેહદારોની શ્રેણીના અધિકૃત પ્રતિનિધિ તરીકે કાર્ય કરે એવા ઇન્ફોર્મેટની વેપારીઓના નામ (દરેક શ્રેણી માટે શ્રા નામ)
14	(a) સંબંધિત કોર્સ અને (b) અધિકૃત પ્રતિનિધિ ઉપલબ્ધ હોય તો તેની વિગતો

આ સાથે નોટિસ આપવામાં આવી છે કે નેશનલ કંપની લી ટ્રિબ્યુનલ, અમદાવાદ બેંચે તા. ૨૯.૦૭.૨૦૨૫ ના આદેશ નં. CP (IB) 271/17/AHM/2025 દ્વારા, **રઝીગા પેપર મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ**ની કોર્પોરેટ નાદારી કરાવક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે અને તે જ આદેશ દ્વારા શ્રી ઝુગર તરુણકુમાર ભક્ષને ઇથરનિમ કિંગ્ડોમ્સ પ્રોજેક્શનલ (IRP) તરીકે નિયુક્ત કર્યાં છે. આથી **રઝીગા પેપર મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ** ના લેહદારોને તેમના દાવા પુરાવા સાથે **૧૩.૦૮.૨૦૨૫** ના રોજ અથવા તેના પહેલાં અંતિમિ રેગ્યુલેશન વ્યવસાયીકને એટ્ટી નં. ૧૪માં જણાવેલા સરનામા પર રજૂનાત કરવા જણાવવામાં આવે છે.

નાણાકીય લેહદારો તેમના દાવા પુરાવા સાથે માઇ ક્રેડિટોરલિ ઉપાય દ્વારા રજૂનાત કરી શકશે. અન્ય તમામ લેહદારો તેમના દાવા પુરાવા સાથે વાલિડેનગ રીટ, પેરેટ દ્વારા અથવા ઇથરક્રોનિક ઉપાય દ્વારા રજૂનાત કરી શકે છે.

એટ્ટી નં. ૧૨ની સામે દર્શાવ્યા મુજબની શ્રેણીથી સંબંધિત નાણાકીય લેહદારોએ કોર્મ સી.એ.માં અધિકૃત પ્રતિનિધિ તરીકે કાર્ય કરવા એટ્ટી નં. ૧૩ ની સામેની ચાર્ટર્મિના ગ્રાહ ઇન્ફોર્મેટની બોહેશનલ્સમાંથી તેમના અધિકૃત પ્રતિનિધિની પસંદગી દર્શાવવાની રહેશે - વર્તમાન કેસમાં નહીં.

**દાવાના ખોટા અથવા ગેરમાર્ગે દોરનારા પુરાવાની રજૂનાત કરનારે પેનલ્ટી ભરવી પડશે.**

<div> <b>APL APOLLO TUBES LIMITED</b></div> <div>Registered Office: 37, Hargobind Enclave, Vikas Marg, Delhi - 110092 Corporate Office: SG Center, Block-B, 37C, Sector 132, Noida - 201304 Uttar Pradesh. Tel.: 91-120-6918000 CIN: L74899DL1986PLC023443 Email: <a href="mailto:investors@aplapollo.com">investors@aplapollo.com</a> Website: <a href="http://www.aplapollo.com">www.aplapollo.com</a></div>	
<b>Notice to Shareholders for Transfer of Equity shares of the Company to Investor Education &amp; Protection Fund (IEPF)</b>	
<p>This Notice is being published pursuant to the provisions of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended from time to time ("the Rules"). The said Rules prescribe the manner of dealing with the unclaimed shares in respect of which dividend have remained unclaimed/unpaid for a period of seven consecutive years. As per the said Rules, such shares along with unclaimed/unpaid dividend shall be transferred to the Investor Education and Protection Fund ("IEPF"). The list of such shareholders is uploaded on the Company's website at <a href="https://aplapollo.com/downloads">https://aplapollo.com/downloads</a>.</p> <p>In compliance with the said Rules, individual notices have been sent to the shareholders who have not encashed their dividend since the Final Dividend for FY 2017-18, or who have otherwise obtained any order(s) from Court/Tribunal/Statutory authorities, etc. in respect of their shares. These notices were sent at their latest available address and through e-mail whose e-mail address registered with the Company/Registrar and Transfer Agent, providing them with an opportunity to claim their unclaimed/unpaid dividend and take necessary action to avoid transfer of such shares to IEPF.</p> <p>The concerned shareholders are requested to write to the Company/Registrar and Share Transfer Agent ("RTA"), along with proof of dividend encashment or relevant document(s) order(s) etc., as the case may be at the earliest but not later than November 3, 2025. For any clarification, shareholders are requested to refer to the individual notices sent to them or contact the RTA at Abhipra Capital Limited, A-387, Abhipra Complex, Dilkhush, GT Karnal Rd, Wazirpur Industrial Area, Azadpur, Delhi, 110033 or to the email ID: <a href="mailto:Investors@aplapollo.com">Investors@aplapollo.com</a> (please quote folio/DP-Client ID number in all correspondence).</p> <p>Shareholders holding shares in physical mode, who have not yet updated their PAN, KYC details, are requested to do so by submitting Form ISR-1, Form ISR-2, self-attested copy of PAN (of all holders, in case of joint holding), a cancelled cheque etc., to the RTA of the Company. Detailed instructions and specimen KYC forms are available on the Company's website at <a href="https://aplapollo.com">https://aplapollo.com</a>.</p> <p>Please note that in case the Company doesn't receive any communication including a valid claim from the concerned shareholder latest by November 3, 2025, the Company shall proceed to transfer their shares to the IEPF's Demat Account, without any further act or liability on the part of the Company.</p> <p>Further, to avail the inherent advantages of dematerialization, shareholders holding shares in physical form are requested to convert their holding into dematerialized mode at the earliest. For more details, please visit <a href="https://aplapollo.com">https://aplapollo.com</a>.</p> <p><b>Special window for Re-Lodgement of transfer request of physical shares:</b> Pursuant to SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/CIR/2025/97 dated July 2, 2025, a special window is being provided for July 7, 2025 to January 6, 2026 to facilitate the re-lodgement of transfer requests of physical shares. This facility is available only for the transfer deeds lodged before April 1, 2019 that were rejected, returned, or left unattended due to documentation or process issues.</p> <p>The request may be submitted to the Company's Registrar &amp; Share Transfer Agent (RTA): Abhipra Capital Limited, Abhipra Complex, Dilkhush Industrial Area, G.T. Karnal Road, Azadpur, New Delhi - 110033 011-42390725 E-mail: <a href="mailto:rtat@abhipra.com">rtat@abhipra.com</a></p> <p>Note: Re-lodged transfers will be processed only in demat form. A demat account is mandatory. Investors must provide Client Master List along with Transfer Documents, Share Certificates and other relevant documents. No requests will be accepted after January 6, 2026.</p>	
<div>For APL Apollo Tubes Limited</div> <div>Sd/- Vipul Jain Company Secretary &amp; Compliance Officer</div>	
<div>Date: July 30, 2025 Place: Noida</div>	

**કબજ નોટિસ**  
(સ્થાવર મિલકત માટે)

**જે અંતર્ગત,**

નીચે સહી કરનાર, કે જે સિક્યુરિટાઈઝેશન એન્ડ રિસ્ક્લક્શન બોર્ડ ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ફ્રેસ્ટ એક્ટ 2002 હેઠળ સમ્માન કેપિટલ લિમિટેડ ના (CIN:L65922DL2005PLC136029) (અગાઉ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતું હતું) અધિકૃત અધિકારી છે અને કલમ 13(12) ના વાંચન સાથે સિક્યુરીટી ઇન્ફ્રેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ 2002 ના નિયમ ૩ હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરતાં 13.09.2021 ના રોજ ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવી છે. જેમાં ખરીદદારો સુધીર ભરતભાઈ સતારીયા અને નમ્રતાબેન એસ સતારીયા ને નોટિસમાં જણાવેલી લોન ખાતું નં. HHLSUA00440646 સામે કથિત સૂચના પ્રાપ્ત થયાની તારીખથી 60 દિવસની અંદર હકીકતમાં સુકવણી થાય ત્યાં સુધી 25.06.2021 થી વ્યાજ દરે રૂ. 36,83,452.95 (રૂપિયા છત્રીસ લાખ ત્રેતાસી હજાર ચારસો ભાવન અને પંચાણું પૈસા માત્ર) ની સૂચનામાં ઉલ્લેખ કરાયેલી રકમની ભાવિ વ્યાજે સુકવણીની તારીખ સુધી પુનઃ સુકવણી કરવા માટે આ સાથે જાણ કરવામાં આવેલ છે.

કર્જદાર આ રકમ સુકવવામાં નિષ્ફળ જવાથી સામાન્ય જનતાને આ દ્વારા સૂચના આપવામાં આવે છે કે, નીચે સહી કર્તા દ્વારા સિક્યુરીટી ઇન્ફ્રેસ્ટ (એન્ફોર્સમેન્ટ) - રૂલ્સ - 2002 સૂચિત કાયદો નિયમ 8 સાથે વાંચતા તેની કલમ 13 ની પેટા - કલમ (4) હેઠળ તેને આપાયેલી સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે વર્ણન કરાયેલી મિલકતના કબ્જે તારીખ 26.07.2025. ના રોજ લેવામાં આવ્યો છે.

ખાસ કરીને કર્જદાર અને જાહેર જનતાને અત્રે ચેતવવામાં આવે છે કે કથિત મિલકતના સોદામાં પડવું નહીં અને જો તે મિલકતને લગતા કોઈ પણ સોદા કરવામાં આવશે તો રૂ. 36,83,452.95 (રૂપિયા છત્રીસ લાખ ત્રેતાસી હજાર ચારસો ભાવન અને પંચાણું પૈસા માત્ર) 25.06.2021 ની તારીખથી અને તેના ઉપર ચકત વ્યાજ સમ્માન કેપિટલ લિમિટેડ (અગાઉ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતું હતું) ના હકને આધીન રહેશે.

સુરક્ષીત અરુદ્યામતોને પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયના સંબંધમાં અધિનિયમની કલમ 13 ની પેટા કલમ (8) ની જોગવાઈ મુજબ ઉધાર લેનાર નું ધ્યાન દોરવામાં (આમંત્રિત) કરવામાં આવેલ છે.

**સ્થાવર મિલકતનું વર્ણન**

બંગલો નં. 251, સ્વપ્ન વિલા, આચાર્ય નં. 356 અને 357, બ્લોક નં. 343, દાદા ભગવાન મંદિર પાસે, સુરત, ગુજરાત - 394180.

**સહી/-**  
અધિકૃત અધિકારી  
સમ્માન કેપિટલ લિમિટેડ

તારીખ : 26.07.2025  
સ્થળ : સુરત

**(અગાઉ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતું હતું)**